

Exchange of list of prisoners between India and Pakistan

July 01, 2022

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેદીઓની સૂચિનું આદાનપ્રદાન

જુલાઈ 01, 2022

આજે ભારત અને પાકિસ્તાને નવી દિલ્હીમાં અને ઈસ્લામાબાદમાં અનુક્રમે રાજદ્વારી ચેનલો મારફત તેઓનાં કબ્જામાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની સૂચિઓનું આદાનપ્રદાન કર્યું હતું. રાજદ્વારી સુલભતા પર 2008 ની સમજૂતિમી જોગવાઈઓ અંતર્ગત, દર વર્ષે 01 જાન્યુઆરી અને 01 જુલાઈનાં રોજ આવી સૂચિઓની આપ-લે કરવામાં આવે છે.

ભારત દ્વારા ભારતનાં કબ્જામાં રહેલા 309 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 95 માછીમારોની સૂચિ પાકિસ્તાનને સોંપી હતી. તેવી જ રીતે, પાકિસ્તાને તેનાં કબ્જામાં રહેલા ભારતીયો હોય અથવા ભારતીયો હોવાનું માનવામાં આવતું હોય તેવા 49 નાગરિક કેદીઓ અને 633 માછીમારોની સૂચિઓ શેર કરી હતી.

સરકારે નાગરિક કેદીઓ, ગુમ થયેલા ભારતીય સંરક્ષણ વ્યક્તિઓ અને માછીમારોને તેઓની હોડીઓ સાથે પાકિસ્તાનનાં કબ્જા માંથી વહેલા મુક્ત કરવા અને સ્વદેશ પ્રત્યાવર્તન માટે આલવાન કર્યું હતું. આ સંદર્ભમાં, પાકિસ્તાનને જેઓની રાષ્ટ્રિયતાની પુષ્ટિ કરવામાં આવી છે અને જેઓએ તેઓની સજા પૂર્ણ કરી છે તેવા 536 ભારતીય માછીમારો અને 03 ભારતીય નાગરિક કેદીઓને ઝડપથી મુક્ત કરી ભારત પ્રત્યાવર્તન કરવા માટે કહેવામાં આવ્યું હતું આ ઉપરાંત, ભારતીય હોવાનું માનવામાં આવે છે તેવા પાકિસ્તાનનાં કબ્જામાં રહેલા બાકીનાં 105 માછીમારો અને 20 નાગરિક કેદીઓને તાત્કાલિક રાજદ્વારી સુલભતા પ્રદાન કરવા માટે પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે.

ભારત એકબીજાનાં દેશોમાં રહેલા કેદીઓ અને માછીમારો સંબંધિત બાબતો સહિત તમામ માનવીય બાબતો પ્રાથમિકતાનાં ધોરણે સંબોધવા પ્રતિબદ્ધ રહે છે. આ સંદર્ભમાં, ભારતે પાકિસ્તાનને પાકિસ્તાન દ્વારા રાષ્ટ્રિયતાની પુષ્ટિ કરવાની માંગ બાબતમાં પડતર પ્રત્યાવર્તન કરવાનું હોય તેવા માછીમારો સહિત 57 પાકિસ્તાની કેદીઓની રાષ્ટ્રિયતાની સ્થિતિની પુષ્ટિ કરવા માટે તેનાં તરફથી જરૂરી કાર્યવાહી ઝડપી બનાવવા માટે પણ વિનંતી કરી છે. કોવિડ-19 મહામારીને દ્રષ્ટિમાં રાખતા, પાકિસ્તાનને તમામ ભારતીય અને ભારતીય હોવાનું માનવામાં આવે છે તેવા નાગરિક કેદીઓ અને માછીમારોની સુરક્ષા, સલામતિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

નવી દિલ્હી

જુલાઈ 01, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.